



# વિપ્રચના

સાધકોનું માસિક  
પ્રેરણાપત્ર

બુદ્ધવર્ષ 2552 ♦ કાર્તિક પૂર્ણિમા ♦ 13 નવેમ્બર 2008 ♦ વર્ષ - 9 ♦ અંક - 8 ♦ સંંગ અંક - 104

## ધર્મવાણી

સન્તકાયો સન્તવાચો, સન્તવા સુસમાહિતો ।  
વન્તલોકમિસો ભિક્ખુ, ઉપસન્તોતિ વુચ્ચતિ ॥  
(ધર્મપદ ૨૫-૧૧)

શરીર અને વચનથી શાંત, સુપેરે (સમ્યક) સમાધિયુક્ત, શાંતિપ્રાપ્ત તથા  
લોકના આમિષને વમન કરી દીઘેલા (વિતૃષણ) બિક્ષુને (સાધકને) 'ઉપશાંત'  
કહેવાય છે.

## સમાધિ સમ્યક હોય

(શ્રી ટીવી પર કમશા: ચુમાળીસ કડીઓમાં પ્રસારિત પૂર્ણ ગુરુજીનાં પ્રવચનોની અગિયારમી કડી)

આઠ અંગવાળા ધર્મપંથના ત્રણ વિભાગ શીલ, સમાધિ અને  
પ્રજ્ઞા. શીલની અંતર્ગત ધર્મનાં ત્રણ અંગ આવ્યાં - સમ્માવાચા,  
સમ્માકમ્મન્તો, સમ્માઆજીવો.

આપણાં વાચિક કર્મ સમ્યક હોય, શુદ્ધ હોય અને એ  
આપણા જીવનમાં ઊતરે, અનુભૂતિ પર ઊતરે; આપણાં કાચિક કર્મ  
સમ્યક હોય, શુદ્ધ હોય અને જીવનમાં ઊતરે, અનુભૂતિ પર ઊતરે;  
આપણી આજુવિકા સમ્યક હોય, શુદ્ધ હોય અને જીવનમાં ઊતરે,  
અનુભૂતિ પર ઊતરે; તો જ, આ શીલનું ક્ષેત્ર સમ્યક હોય.

બીજો વિભાગ - સમાધિનું ક્ષેત્ર, જેમાં ધર્મનાં અન્ય ત્રણ  
અંગ આવ્યાં : સમ્માવાયામો, સમ્માસતિ, સમ્માસમાધિ.

સમ્યક વ્યાચામ, ઉચિત વ્યાચામ, કલ્યાણકારી વ્યાચામ.  
આપણું શરીર કમજોર થઈજાય, એટલું દુર્બળ, એટલું રોગી થઈજાય કે  
બે કદમ પણ દઢતાપૂર્વક ચાલી ન શકે, લથડિયાં ખાય, ડગમગે; તો  
કોઈ સમજદાર માણસ કહેશ - અરે ભાઈ, આ શરીરની કોઈ કસરત  
નથી કરતા ! કરવી જોઈએ, શરીરની માંસપેશીઓને પુષ્ટ કરવી  
જોઈએ, જેથી શરીર સબળ થઈજાય, નીરોગી થઈજાય.

બરાબર એ જ પ્રકારે જ્યારે આપણું મન દુર્બળ થઈજાય,  
રોગી થઈજાય, ડગમગવા લાગે; અને જ્યારે કોઈ વ્યક્તિ વિપશયનાની  
તપોભૂમિમાં આવીને, અંતર્મુખી થઈને પોતાના બારામાં સરચાઈનું  
નિરીક્ષણ કરવાનું શરીર કરે છે તો બહુ શીદ્ધ અનુભૂતિઓથી સમજમાં  
આવવા લાગે છે કે અરે, કેવું રોગી મન લઇને ફરું છું ! કેવું દુર્બળ મન  
લઇને ફરું છું ! કેવું ડગમગે છે ! કેવું ડગમગે છે !! ને શ્વાસ સુધી પણ દઢ  
નથી રહી શકતું ! અરે, ખરેખર દુર્બળ છે, રોગી છે ! તો એને સબળ  
બનાવવાને માટે, નીરોગી બનાવવાને માટે જે કસરત છે તે જ સમ્યક  
વ્યાચામ છે.

ચાર પ્રકારની કસરત હોય છે મનને નીરોગી બનાવવાની,  
સબળ બનાવવાની. પહેલી કસરત : પોતાના મનને જોઈએ છીએ -  
પોતાની ભીતર. આખેઆખો માર્ગ પોતાની ભીતર કાચાના બારામાં જે  
સરચાઈ છે તેને અનુભૂતિઓથી જાણવાનો છે. તો અનુભૂતિઓથી  
જાણીએ છીએ, પોતાની ભીતર, પોતાના મનની હાલત. મારા મનમાં  
આ દુર્ગુણ છે, આ દુર્ગુણ છે. આવું જોઈને મનમાં કોઈ અપરાધની ગ્રંથિ

ન બાંધી લઈએ. સત્યને યથાવત જેવું છે તેવું સ્વીકાર કરવાનું છે. આ  
દુર્ગુણ છે તો તેને કાઢવાના છે. તો પહેલી કસરત છે કે જે દુર્ગુણ છે તેને  
ધીરે ધીરે કાઢીએ, દૂર કરીએ, પહેલી સારી કસરત થઈ. સમ્યક  
વ્યાચામ થયો.

બીજુ કસરત : ફરી પોતાની તરફ જુએ છે, પોતાની ભીતર,  
પોતાની તરફ ડોકિયું કરીને જુએ છે. પોતાના મનના બારામાં જુએ છે કે  
મારા મનમાં અમુક દુર્ગુણ તો બિલકુલ નથી ; અમુક દુર્ગુણ તો બિલકુલ  
નથી. બહુ સારી વાત. જે દુર્ગુણ નથી તે કયાંક આવી ન જાય. તો મનના  
બધા દરવાજા બંધ. જે દુર્ગુણ નથી તે ભીતર ન આવી જાય. બીજુ  
કસરત થઈ. બહુ કામની કસરત થઈ. તો સમ્યક વ્યાચામ થયો.

ત્રીજુ કસરત, ફરી પોતાના મનમાં ડોકિયું કરીને જુએ છે કે મારા  
મનમાં આ સદગુણ છે, આ સદગુણ છે. તો ગરવથી નથી  
છલકાતો, ઘમંડથી નથી છલકાતો. આ સદગુણ છે, સારી વાત છે, એ  
કયાંક નીકળી ન જાય. તેને સંભાળીને રાખવાના છે અને સંભાળીને જ  
નહિ, બલ્કે તેનું સંવર્ધન કરવાનું છે. ત્રીજુ કસરત થઈ.

ચોથી કસરત : ફરી પોતાના મનને તપાસીને જુએ છે કે અરે,  
મારા મનમાં અમુક સદગુણ તો છે જ નહીં ! અમુક સદગુણ તો છે જ  
નહીં ! તો જે સદગુણ નથી તેને માટે બધા દરવાજા ખુલે. આવો ! તેનું  
રોકાણ કરે છે. એ સદગુણ પોતાના મનમાં લાવે છે. ચોથી કસરત થઈ.

બસ આ ચાર કસરત કરવા લાગ્યો તો વ્યાચામ સમ્યક થઈ  
ગયો. જે દુર્ગુણ છે તેને બહાર કાઢે ; જે દુર્ગુણ નથી તેને ભીતર આવવા  
ન હૈ ; જે સદગુણ છે તેને સુરક્ષિત જ ન રાખે તેનું સંવર્ધન કરે ; અને જે  
સદગુણ નથી તેને પોતાના મનમાં પ્રવેશ આપવાનો પ્રયત્ન કરે. બસ,  
આ ચાર વ્યાચામ, તેને જ સમ્માવાયામો સમ્યક વ્યાચામ, સમ્યક  
પ્રયત્ન, સમ્યક પરિશ્રમ, સમ્યક પુરુષાર્થ કહ્યા.

આગામું અંગ - સમ્માસતિ સતિ એટલે સ્મૃતિ. ૨૫૦૦ વર્ષમાં  
ભાષા બદલે છે, શબ્દ બદલે છે, શબ્દોના અર્થ બદલે છે. આજે તો  
ભારતની બધી ભાષાઓમાં 'સ્મૃતિ' શબ્દનો એક જ અર્થ રહી ગયો,  
Memory, યાદશક્તિ. ૨૫૦૦-૨૬૦૦ વર્ષ પૂર્વેના ભારતમાં કેવળ  
આ જ અર્થ નહોતો, એક બીજો અર્થ હતો અને તે બહુ મહિયપૂર્ણ અર્થ  
હતો - સજગતા, સમ્યક સજગતા. કઈ વાતની સજગતા ? પોતાની

ભીતર જે સચ્ચાઈ પ્રગટ થઈ રહી છે, પોતાના બારામાં એટલે કે આ શરીર-સ્કંધના બારામાં આ ચિત્ત સ્કંધના બારામાં, આ બંનેના પારસ્પરિક સંબંધોના બારામાં જે સચ્ચાઈ પ્રગટ થઈ રહી છે તેને ચથથાભૂત, ચથથાભૂત જાગ્રત રહીને જાણી રહ્યો છે; આ જ સમ્યકુષ સ્મૃતિ છે, સજગતા છે. જે ખરેખર થઈ રહ્યું છે, બસ એ જ. અને જે ખરેખર થઈ રહ્યું છે તેનું કોઈ ચિંતન-મનન નથી, તેની કોઈ કલ્પના નથી. અનુભૂતિ પર ઉંતરી રહ્યું છે.

સ્મૃતિ સમ્યકુષ ત્યારે થાય જયારે અનુભૂતિ પર ઉંતરવા લાગે. આ શ્વાસ આવી રહ્યો છે. આ શ્વાસ જઈ રહ્યો છે. શ્વાસ પ્રત્યે સજગ છે. ડાબા નસકોરામાંથી પસાર થઈ રહ્યો છે કે જમાણા નસકોરામાંથી પસાર થઈ રહ્યો છે તે બંને નસકોરામાંથી પસાર થઈ રહ્યો છે. ખૂબ સજગ છે. કયાં સ્પર્શ રહ્યો છે? કયાં અડી રહ્યો છે? ખૂબ સજગ છે. લાંબો છે કે ટ્રૂંકો? જેવો પણ છે, ખૂબ સજગ છે. પોતાના શ્વાસ પ્રત્યે સજગ રહેતાં-રહેતાં-રહેતાં ત્રણ દિવસો સુધી મનની આ સજગતા શરીરના દરવાજાઓ પર, નાસિકાના દરવાજાઓ પર, એ જ સ્થાન પર સ્થિર છે. મનને સ્થિર કરીને સજગતાનો અભ્યાસ કરીએ છીએ અને જેમ જેમ આ અભ્યાસમાં પરિપક્વ થતાં જઈએ છીએ (તેમ તેમ) જોઈએ છીએ કે મન નીરોગી થવા લાગ્યું. જરા સબળ થવા લાગ્યું. તેની ચંચળતા જરા ઓછી થવા લાગી. તેમાં સ્થિરતા આવવા લાગી અને એ સ્થૂળ મન સૂક્ષ્મ થવા લાગ્યું. સૂક્ષ્મ થવા લાગ્યું. સૂક્ષ્મ ચચ્ચાઈઓને અનુભૂતિ પર ઉંતરવા લાગ્યું. કોઈ કલ્પનાને સ્થાન નહીં. સચ્ચાઈઓને અનુભૂતિઓ પર ઉંતારી રહ્યું છે. અનુભૂતિઓ પર ઉંતારી રહ્યું છે તો સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ આગળ વધી રહ્યું છે.

આરંભમાં પોતાના શરીર અને ચિત્તના બારામાં ઘણી સ્થૂળ-સ્થૂળ સચ્ચાઈઓ પ્રગટ થાય છે. તેમના પ્રતિ સજગ રહે છે, સાવધાન રહે છે. જે થઈ રહ્યું છે તેને નથી તો નઠાડું માનતો કે નથી તેને સારું માનતો. આવું થઈ રહ્યું છે, બસ! અને એ જાણાઈ રહ્યું છે, બસ! એટલું જ! તેને જાણી રહ્યો છે, જાણી રહ્યો છે, તો સ્મૃતિ સજગ થતી જાય છે. સ્મૃતિ બળવાન થતી જાય છે એટલે કે સજગતા બળવાન થતી જાય છે. પોતાના બારામાં જે કાંઈ થઈ રહ્યું છે તેને જાણવાના કામમાં બળવાન થતો જાય છે. આગળ વધતાં-વધતાં-વધતાં આખા શરીરમાં શું થઈ રહ્યું છે તેને જાણવા લાગશે.

બહારના સંસારમાં શું થઈ રહ્યું છે તેના પ્રતિ પણ સજગ રહેવું જોઈએ, એમાં બેમત નથી. પરંતુ કેવળ બહારની દુનિયા પ્રત્યે જ સજગ થયને રહી જઈશું, પોતાની ભીતર શું થઈ રહ્યું છે તેને નહિ જાણીએ તો પોતાની ભીતર પોતાના માનસને સુધારવાનું કામ કર્યી રીતે કરીશું? પોતાની ભીતર, પોતાના બારામાં જે સચ્ચાઈ છે તેને જાણવાનું કામ શી રીતે કરીશું? પોતાની ભીતર પોતાના માનસમાં જે વિકારોનો ઉદ્ગમ થઈ રહ્યો છે. પ્રજનન થઈ રહ્યું છે, તેનું સંવર્ધન થઈ રહ્યું છે એ સચ્ચાઈને શી રીતે જાણવા પામશું? ચિંતન-મનન ભલે કરી લઈએ, જાણવા નહિ પામીએ. અને આખો માર્ગ તો સમ્યકુષ્યનો માર્ગ એટલે કે અનુભૂતિ થાય. આ સજગતાની અનુભૂતિ થાય. સજગતા અનુભવ પર ઉંતરી રહી હોય, તો સમજવું કે ઠીક રસ્તા પર ચાલી રહ્યા છીએ. બિલકુલ ઠીક રસ્તે ચાલી રહ્યા છીએ. કાચાની ભીતર સ્થિત થઈ જઈશું.

નિચ્ચં કાયગતા સત્તિ, નિચ્ચં કાયગતા સત્તિ. આ કાચાની ભીતર જે ગતિવિધિ થઈ રહી છે, જે ગતિઓ થઈ રહી છે, તેના પ્રતિ ખૂબ

સત્તિ છે, ખૂબ સજગ છે, ખૂબ જાગૃત છે, કાચામાં સ્થિત થઈ ગયો. જે કાચામાં સ્થિત થઈ ગયો તે કાચાની ભીતર પોતાના વિકારોને કાઢવામાં સફળ થઈ ગયો.

આ કાચા પ્રત્યે જે ‘હું-હું, મારું-મારું’ નો ભાવ છે તેનાથી છુટકારો પામવામાં સફળ થઈ ગયો. આ કાચા પ્રતિ જે ઊંડી આસક્તિ પેદા કરી લીધી તેનાથી છુટકારો પામવામાં સફળ થઈ ગયો. આ ચિત્ત પ્રતિ જે ‘હું-હું, મારું-મારું’ નો ભાવ છે તેના પ્રતિ જે ઊંડું તાદાતમ્ય થઈ ગયું, તેનાથી છુટકારો પામવામાં સફળ થઈ ગયો. આ ચિત્ત પ્રતિ જે ઊંડી આસક્તિ પેદા થઈ થઈ તેનાથી છુટકારો પામવામાં સફળ થઈ ગયો. તો બસ, મુક્તિના રસ્તે ચાલી નીકળ્યો, મુક્તિના રસ્તે ચાલી નીકળ્યો.

આ સ્મૃતિ સમ્યકુષ ન હોય, અનુભૂતિવાળી ન હોય, કેવળ બોદ્ધિક સ્તર પર જ સમજુને રહી જઈએ તો પૂરી વાત ન બને. પણ તો બુદ્ધિનું શુદ્ધીકરણ થાય છે. બુદ્ધિ નિર્મણ થઈ જશે. સારી વાત છે. એટલી-એટલી તો નિર્મણતા આવી પણ અંતમનાં ઊંડાણ સુધી આપણી પાસે જે વિકારોનો સંગ્રહ લઈને ફરી રહ્યા છીએ, જે વિકારોનો જે સંચય છે, તેને કાઢવાનું કામ બિલકુલ ન કરી શકાયા. તો, સ્મૃતિ સમ્યકુષ ત્યારે કે જયારે આખા શરીરસ્કંધમાં, આખા ચિત્તસ્કંધમાં જે કાંઈ થઈ રહ્યું છે, તેને કાણા-પ્રતિક્ષણા, કાણા-પ્રતિક્ષણા જાણી રહ્યા છીએ. તો સજગતા સમ્યકુષે.

આ કાણો પોતાના શરીરના બારામાં, પોતાના ચિત્તના બારામાં જે સચ્ચાઈ પ્રગટ થઈ તેને જાણી લીધી. આગળી કાણ જેવી ‘આ’ કાણ બની કે આ કાણો ફરી શરીર અને ચિત્ત સંબંધિત જે સચ્ચાઈ પ્રગટ થઈ, બસ જાણી લીધી. આગળી કાણ જેવી આ કાણ બની, જે સચ્ચાઈ પ્રગટ થઈ, તેને જાણી લીધી. સચ્ચાઈ પ્રગટ થવી જોઈએ, કલ્પનાઓ નહીં. મારી પરંપરાની આ દાર્શનિક માન્યતા, મારી પરંપરાની આ દાર્શનિક માન્યતા, અમારા સંપ્રદાયની આ દાર્શનિક માન્યતા તેનો લેપ લગાવવાનું શરૂ કરી દીધું અને એ કલ્પનાઓનું દ્યાન કરવા લાગે અને કહે કે હું બહુ સજગ છું. અરે, એ કલ્પનાઓ પ્રત્યે સજગ છો ને ભાઈ! તને અનુભૂતિ કયાં થઈ? અનુભૂતિ પર જે ઉંતરી રહ્યું છે, બસ તેના પ્રત્યે સજગ, તેના જ પ્રત્યે સજગ. ધીરે ધીરે અને લાયક થઈ ગયો કે સજગતા છે, ભલે એક કાણ જ રહી. આગળ વધતાં-વધતાં પાંચ-દસ કાણ રહી, પાંચ-દસ સેક્કડ રહી. એક મિનિટ રહી, બે મિનિટ રહી, પાંચ મિનિટ રહી. આમ સજગ રહેવાની અવધિ વધી રહી છે, વધી રહી છે, વધી રહી છે. આને જ સમાધિ કહે છે. કાણ-પ્રતિક્ષણા ઉત્પન્ન થનારા કોઈ આલંબન પર ચિત્ત ખૂબ સજગ થઈને જોઈ રહ્યું છે અને લાંબા અરસા સુધી જોઈ રહ્યું છે તો સમાધિ થઈ.

સમાધિ પણ સમ્યકુષ સમાધિ થાય તો કામની વાત છે. આલંબન સચ્ચાઈનું હોય, કલ્પનાઓનું નહીં. કોઈ કલ્પનાનું દ્યાન કરતાં કરતાં ચિત્ત એકદમ સમાહિત થઈ જશે. સમાહિત થવું કપરી વાત નથી. કોઈ શબ્દને બેવડાવતાં-બેવડાવતાં-બેવડાવતાં મન એકદમ સમાહિત થઈ જશે, સમાધિસ્થ થઈ જશે. કોઈ કપરી વાત નથી. કોઈ દૃપનું, કોઈ આકૃતિનું દ્યાન કરતાં-કરતાં-કરતાં મન એકદમ સમાધિસ્થ થઈ જશે, સમાહિત થઈ જશે; કોઈ કપરી વાત નથી. પરંતુ આપણે જે કામને માટે નીકળ્યા છીએ કે અંતમના ઊંડાણમાં શરીર અને ચિત્તના પારસ્પરિક સંબંધોને કારણે જે વિકારોની ઉત્પત્તિ થાય છે, તે કયાં થાય છે? તેનું સંવર્ધન થાય છે, તે કયાં થાય છે? કઈ રીતે

થાય છે ? કઈ રીતે એ સંવર્ધનને રોકી શકાય છે ? અને કઈ રીતે વિકારોના સંચયનો નિકાલ કરી શકાય છે ? આ બધી વાતો એક કોર રહી ગઈ.

આપણું ઉપર-ઉપરનું ચિત્ત સમાહિત થઈ ગયું તો બહુ શાંત થઈ ગયું, અને શાંત જ નહિ, એક અર્થમાં થોડું નિર્ભળ પણ થયું. પણ હંમેશા નિર્ભળ થતું હોય એ આપશ્યક નથી. તેને માટે ચિત્ત એકાગ્ર હોય અને કુશળતા (શુભ હોવાપણું) પણ સાથે હોય - કુસલચિત્તસ્સ એકગતા એટલે કે ચિત્તની કુશળતા કાયમ હોય એટલે કે તેમાં અકુશળ (અશુભ) ચિત્તવૃત્તિઓ ન જાગે. કુશળ ચિત્તવૃત્તિઓની સાથે ચિત્ત એકાગ્ર થઈ રહ્યું છે તો સમ્યક્ સમાધિ છે, અન્યથા ચિત્તની એકાગ્રતા તો કેવળ સમાધિ છે. તો કેવળ સમાધિથી વાત નથી બનતી.

સમ્યક્ સમાધિ એ કે જેનું આલંબન રાગના આધારવાળું નથી, દ્રેષના આધારવાળું નથી, મોહ-મૂઢતાના આધારવાળું નથી.

સમાધિઓ તો થઈ જાય છે - રાગના આધારે પણ, દ્રેષના આધારે પણ, કલ્પનાઓના આધારે પણ. (અને) મોહ-મૂઢતાના આધારે પણ !

ઉદાહરણોથી સમજુએ. તળાવના કિનારે એક બગલો ઊભો છે. એક પગો ઊભો છે. કેટલો સમાધિસ્થ છે ! કેટલો દ્યાનસ્થ છે ! જરીકે ય નથી હલતો ! નથી શરીર હલતું, નથી મન હલતું. બધું દ્યાન કઈ વાત પર છે ? આ પાણીમાં ક્યાંક તરીને આપતી કોઈ માછિલી દેખાઈ જાય ! માછિલી દેખી કે તને હક્ક કરશે. તેને માટે સમાધિસ્થ છે, દ્યાનસ્થ છે.

કોઈ બિલ્લીને જોઈહશે. ઉંદરના દરની પાસે કેવી ઊભી છે ? એક ઝંપાંદુંયે નથી હલતું એનું ! બહુ દ્યાનસ્થ છે, બહુ સમાધિસ્થ છે. કદ્વાતને લઈને ? આ દરમાંથી કોઈ ઉંદર નિકળે અને એને ઝડપી લે ! સમાધિસ્થ છે !

એક શિકારીને જોયો હશે. પોતાની બેનાળી, બંદૂક પર કેવો સમાધિ લગાવીને બેઠો છે ! સામેથી કોઈ શિકાર દેખાઈ જાય અને ‘ધાંય’ એને મારીદે ! સમાધિસ્થ છે !

અરે, દુનિયાનું બૂરામાં બૂરું કામ પણ ચિત્તને એકાગ્ર કરીને થાય છે. તો, ચિત્તને એકાગ્ર કરી લેવું (તે) આ ધર્મપંથનું અંગ નથી. કુશળ ચિત્તને એકાગ્ર કરી લેવું એટલે કે આલંબન રાગવાળું ન હોય ; આલંબન દ્રેષ્યવાળું ન હોય ; આલંબન કલ્પનાઓનું, મિથ્યા માન્યતાઓનું, મોહ-મૂઢતાનું ન હોય, જે સર્ચાઈજેવી પણ છે, બસ, એ સર્ચાઈના આલંબન પર ચિત્ત એકાગ્ર છે. શ્વાસ આવી રહ્યો છે, જઈરહ્યો છે તને જાણી રહ્યો છે. તેમાં કોઈ કલ્પના નહીં. આ સત્ય છે. સાચી વાત અનુભૂતિ પર ઊતરી રહી છે અને પોતાના શરીર તથા ચિત્તથી સંબંધિત છે. આ આલંબન પર ચિત્ત એકાગ્ર છે, ભલે થોડી કાણને માટે. આની અવધિ વધે છે. ફ્રી એકાગ્ર થાય છે થોડી વધુ વારને માટે, થોડી વધુ વારને માટે. તો સમાધિ, સમાધિ, સમાધિ - સમ્યક્ સમાધિ છે. શ્વાસ આવી રહ્યો છે, જઈરહ્યો છે. ન તો આવનારા શ્વાસ પ્રત્યે રાગ છે કે ન તો જનારા જ્યાસ પ્રત્યે દ્રેષ છે. નથી આ મોહ કે અજ્ઞાન કે કલ્પના - કે હું શ્વાસ લઈરહ્યો છું. કોઈ કલ્પના નથી. ખરેખર સર્ચાઈ અનુભૂતિ પર ઊતરી રહી છે. નથી આલંબનને લઈને મનમાં દ્રેષ જાગતો. તો બહુ શુદ્ધ આલંબન છે.

બસ, અહીંથી કામ શરૂ કર્યું. આ આલંબનના સહારે-સહારે જેમ જેમ ચિત્ત એકાગ્ર થતું જશે, (તેમ તેમ) સમાધિ એકાગ્ર થતી જશે. તેનાથી વધુ સૂક્ષ્મ, વધુ સૂક્ષ્મ, વધુ સૂક્ષ્મ. આ કાયાની ભીતર શું થઈ રહ્યું છે, એ બધી સૂક્ષ્મ અવસ્થાઓનું સ્વયં દર્શન કરવાનું શરૂ કરી દેશે, અનુભવ કરવાનું શરૂ કરી દેશે તો પ્રજા જગાવવાનું કામ થઈ જશે.

શીલ શુદ્ધ ન હોય તો સમાધિ સમ્યક્ નથી હોતી. હોઈ જ ન શકે. તે સમયના ભારતમાં, હમણાં કહ્યું તેમ, એવા આચાર્યો હતા જેમને શીલ-સદાચાર સાથે કશી લેવા દેવા નહીં ! શું રાખ્યું છે શીલ-સદાચારમાં ? જે મનમાં આવે તે કરો અને પછી જુઓ, એવું દ્યાન કરાવશું, એવો આનંદ આવશે, એવો આનંદ આવશે. સામાન્ય વ્યક્તિને શું જોઈએ ? જે મનમાં આવે તે કરો. સદાચારની વાત છોડો અને પછી આ જેમ કહીએ છીએ ને, તેમ કરતા જાઓ ! બહુ લોકો (તેમની) પાછળ લાગી ગયા. એ સમ્યક્ માર્ગ નથી મુક્તિનો માર્ગ નથી, વિશુદ્ધિનો માર્ગ નથી. આનંદ, અરે, કોઈ વાતને લઈને જરાક આનંદ માણી લીધો તો વાત ન બની. એ જ પરંપરાના લોકો જરાક વધુ આગળ જઈને આ વિચારદ્યારાને વ્યક્તિ કરે છે કે યાવત્ જીવેત સુખું જીવેત, ત્રણ કૃત્વા ઘૃત પિબેત - મોજ કરો, ગમે તેમ કરો. કેમ કે ભર્મસીભૂતસ્ય દેહસ્સ પુનર્જન્મં ન વિદ્યતિ । બસ, એક જન્મ છે. જે મોજોખ પૂરા કરવા હોય તે કરી લો. બીજું જે કાંઈએ જોઈએ તે રીતે કરતાં જાઓ તો બહુ આનંદ આવશે.

પરંતુ શુદ્ધ ધર્મનો આ રસ્તો નથી. શુદ્ધ ધર્મને માટે શીલ-સદાચાર આધારશિલાઓ છે, પાચો છે. આ પાચો કમજોર રહી જાય તો ધર્મનું ભવન ઊભું ન થઈ શકે. આ આખી સાધના બેકાર થઈ જશે. જ્યારે શીલના આધાર પર કામ કરે છે તો સમાધિ સમ્યક્ થાય છે. શીલને ભૂતી જાય અને ચિત્તને એકાગ્ર કરી લે તો સમ્યક્ સમાધિ નહિ થાય; અને સમ્યક્ સમાધિ નહિ હોય તો પોતાની અનુભૂતિવાળી પ્રજા નહિ જાગે તો મુક્તિથી બહુ દૂર છે, બહુ દૂર છે.

આપણું શીલ નિર્ભળ થાય, પુષ્ટ થાય. આપણી સમાધિ નિર્ભળ થાય, પુષ્ટ થાય અને પછી જાગે પ્રજા. પ્રજામાં સ્થિત થતાં જઈએ, સ્થિતપ્રજા થતાં જઈએ તો સમજો ધર્મમાં સ્થિત થઈ રહ્યા છીએ. ધર્મની શુદ્ધતામાં સ્થિત થઈ રહ્યા છીએ. પછી તો જીવનમાં ધર્મ ઊતરવા લાગશે. અને જીવનમાં ધર્મ ઊતરશે તો જ મંગલ થશે.

શીલ, સમાધિ, પ્રજામાં પુષ્ટ થઈને જે કોઈ વ્યક્તિએ ધર્મના માર્ગ પર આગળ વધવાનું શરૂ કર્યું, અરે, તેનું મંગલ ને મંગલ જ ! કલ્યાણને કલ્યાણ જ ! તેની સ્વપ્નિને સ્વપ્નિ જ ! મુક્તિ ને મુક્તિ જ !

- કલ્યાણમિત્ર

સત્યનારાયણ ગોયંકા

### બાળકોના ટીચરનો વર્કશૉપ

રાજકોટ ખાતે તા. ૧૨ ડિસેમ્બર સાથે ૧૧ વાગ્યાથી તા. ૧૪ ડિસેમ્બર સાંજ સુધી શુદ્ધવાર-શનિવાર-રવિવાર રાખેલ છે. ૧૧ ડિસેમ્બર સાંજે આવી શકો છો. ડૉ. નિર્ભલાબેન - (સ્ટેટેસ્ટીક એન્ડ ઈન્કોર્પેશન ઓફ વર્ક વાઇચ ચિલ્ડ્રન્સ કોર્પ્સ) પુનાથી ખાસ આ વર્કશૉપ લેવા માટે આવી રહેલ હોય દરેક બાળકોના ટીચરોએ અવશ્ય લાભ લેવા નિયેદન છે. આપના નામ સીરી ઓફિસ અથવા ધર્મકોટ લખાવી શકો છો.

## સાધકોના ઉદ્ગાર

જે જગત્યો, તેનું મૃત્યુ તો અવશ્યભાવી છે. આ શાક્ષત નિયમ છે. તો કોઈ પણ આત્મભીના શરીર છૂટવા ટાણો શોક કરવો કે રોકકળ કરવી અર્થહીન છે. તિસ્સા ગોત્મીને ભગવાન બુઝે એક નાનકડી વાતથી આ સમજાવી દીધું હતું કે મોત બધાંને આવે છે (પુત્ર મોહમાં પાગલ તિસ્સા ગોત્મી બુઝ્ય પાસે ગઈ તો તેમણે કહ્યું, “એવા ઘરેથી ચંપટી એક રાનીના દાણા લઈએ આવ જ્યાં કોઈ મર્યાદન હોય, તો તારો દીકરો જીવતો કરી દઉં.”) અને સાંજ સુધીમાં એ મૃત્યુ અવશ્યભાવી છે એવું જાણી ગઈ). આ શરીર નશવર છે. એ પાંચ મહાભૂતોનું બનેલું છે અને જ્યારે એની ઉપયોગિતા સમાપ્ત થઈ જાય છે ત્યારે એ પાછું એ જ પંચમહાભૂતોમાં ભણી જાય છે - એને દાટી દો, બાળી દો, પાણીમાં વિસર્જન કરી દો - બધાંનો અંત એ જ છે. યજુર્વેદમાં કહ્યું છે ભર્માન્તં શરીર (યજુર્વેદ ૪૦.૧૫) તો પછી કોઈના પણ મૃત્યુનો શોક - સંતાપ શાને?

થાય છે શું? લોકો મૃત વ્યક્તિની સદગતિને માટે પ્રાર્થના કરે છે કે જેથી એને શાંતિ મળે. એ તો પોતાના કમોને અનુસાર કોઈને કોઈ યોગિમાં જશે જ. આપણા કહેવા કરવાથી કંઈથતું હોટું નથી. આ શાંતિ - પ્રાર્થનાઓ આઈ એક રીતે પરિવારેના સાંત્વના દેવા માટે, એમના દુઃખ (મોહ) માં સહાનુભૂતિ પ્રગટ કરવા માટે તથા સામાજિક ઔપયારિકતા નિભાવવા માટે છે.

રોવા - કૂટવાથી કે શોકાતુર થવાથી એ દિવંગત વ્યક્તિને લાભને બદલે હાનિ થાય છે. શોક કરવાથી એક શોકમય વાતાવરણ બને છે, શોકસંતપ્ત તરંગો ઉમટી પડે છે અને એનો પ્રભાવ એ (મૃત વ્યક્તિ) પર પડે છે, જે વ્યાખ્યિત કરનારો હોય છે. એટલું જ નહિ, ઘરમાં પણ એવા જ તરંગો ફેલાય છે અને પરિવારના લોકો પણ એનાથી પ્રભાવિત થાય છે. આસપાસનું વાતાવરણ પણ આ જ તરંગોથી પ્રભાવિત થયા વિના

### દોહા ધરમના

શીલ હમારા શુદ્ધ હો, હો સમાધિ ભી શુદ્ધ ।  
જબ પ્રજા ભી શુદ્ધ હો, હોય તથી હમ શુદ્ધ ॥  
શીલવાન કે દ્યાન સે, પ્રજા જાગ્રત હોય ।  
અંતર કી ગાંઠે ખુલેં, માનસ નિર્મિત હોય ॥  
બિના શીલ ધારણ કિયે, શુદ્ધ સમાધિ ન હોય ।  
બિન સમાધિ પ્રજા નહીં, મુક્તિ કહાં સે હોય ॥

### એક્સેલ કોપ્ફેર લિમિટેડ

૯/૨ - ઇવાપીરી રોડ, ભાવનગર - ૩૬૪ ૦૦૫  
ફોન : ૨૨૧૨૪૦૧-૨-૩ ની મંગળકામનાઓ સાથે

સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર (પત્રિકા વિભાગ) ભાલા ડાઈનિંગ હોલ, પંચનાથ પ્લોટ, રાજકોટ - ૩૬૦ ૦૦૧. પતી પ્રકાશક તથા મુદ્રક : ચંદુલાઈમહેતા, મુદ્રણ સ્થાન : નાઈસ આઈ, “મુક્તિરામ કોમ્પ્લેક્સ”, રાજ્યીય શાળા મેઝન રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૨. દ્વારા રાજકોટ ખાતે પ્રકાશિત. તંત્રી : ભરત કાપડીઆ. વિપશ્યના (ગુજરાતી) પત્રિકાનું લયાજમ : ભાલા ડાઈનિંગ હોલ, પંચનાથ પ્લોટ, રાજકોટ - ૩૬૦ ૦૦૧. નાસરનામે, સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટરના નામે મ. ઓ./. ડ્રાઇવ અથવા રોકડેથી મોકલી શકાશે. (બહારનામના ચેક લેયામાં આપરો નહીં.) રાજકોટ સિટી ઓફિસ : ભાલા ડાઈનિંગ હોલ, પંચનાથ પ્લોટ, રાજકોટ - ૧.

વિપશ્યના 13 નવેમ્બર, 2008

આ પત્રિકામાંની સામગ્રી વિપશ્યના વિશેધન વિન્યાસ, ઈગતપુરીના સૌખ્યાંત્ર્યી તથા વિપશ્યના હિન્દી / અંગ્રેજી પત્રિકાઓના અંકોમાંથી પ્રકાશિત કરાય છે.

ચાર વર્ષનું લયાજમ : રૂ. ૧૦૦/-  
વાર્ષિક લયાજમ : રૂ. ૩૦/-  
(Renewed upto 31.12.2008)

‘વિપશ્યના’ Reg-No. GUJGUJ 08700/6/1/99-TC  
Postal Reg. No. G-RJ-450  
(Renewed upto 31.12.2008)

Posting day-25th of every month,  
Posted at Rajkot RMS - 360 001.  
Write PIN CODE for Correct Delivery

If undelivered please return to :

### સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર (પત્રિકા વિભાગ)

ભાલા ડાઈનિંગ હોલ, પંચનાથ પ્લોટ,  
રાજકોટ - ૩૬૦ ૦૦૧.

કિટી ઓફિસ : ફોન - (૦૨૮૧) ૨૨૨૦૮૯૧-૮૯૯

મોબાઇલ : ૯૪૨૭૨ ૨૧૫૬૧

e-mail : info@kota.dhamma.org

Web site : www.kota.dhamma.org

નથી રહી શકતું. એથી દૂરના લોકો પણ સંતપ્ત થાય છે. રોવું - કૂટવું એ કેવળ મૃત વ્યક્તિ પર જ નહિ, બલ્કે પરિવારજનો તથા આડોશી - પાડોશી બધાં પર ખરાબ પ્રભાવ પાડે છે.

હોવું તો એ જોઈએ કે એ વ્યક્તિનાં કમોનું દ્યાન કરાય - કૃતં સ્મર (ચજુર્વેદ), એણે પોતાના જીવનકાળમાં જે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી, એના પર દબ્ધિપાત કરાય. કેટલો પરિશ્રમ કર્યો, કેટલો પુરુષાર્થ કર્યો, કેવી સ્થિતિમાંથી કેવી સ્થિતિમાં પહોંચ્યો, આર્થિક, સામાજિક, આધ્યાત્મિક રીતે કેવી ઉન્નતિ કરી, પોતાના આચાર - વિચાર - વ્યવહારને કેવો ધર્મભય બનાવ્યો, એથી સ્વયં પોતે કેટલો લાભાન્વિત થયો, એ કેટલી સમતામાં રહ્યો, વગેરે બાળતોનું દ્યાન રાખી એમાંથી લાભ ઉઠાવવો જોઈએ. હવે એ શરીર જર્જરિત થઈ ગયું હતું, એ મશીનના નટ-બોલ્ટ ઘસાઈ ગયા હતા, નકામા થઈ ગયા હતા. બદલવાનો સભય આવી ગયો હતો. હવે નવા શરીર સાથે નવી જીવનનાંના આચારો મૃત્યુ એક પરદાન છે. આ કંઈ છૂટવા પછી એક નવું, કોમળ, સુંદર, સ્કુર્ટિભય શરીર મળે છે, જે પાછલા જબના સંસ્કારો, ઉપલબ્ધિઓના બળે હજુ વધુ આગળ વધારે છે અને નવા કીર્તિમાન (Record) સ્થાપિત કરતાં કરતાં કંગળે કંગળે આગળ વધતાં અંતિમ લદ્ય સુધી પહોંચાડે છે.

આવા મનોવિચાર રખાય તો શોકાકુળ વાતાવરણ ન રહેતાં એક સ્વસ્થ અને આશાપૂર્ણ વાતાવરણ બનશે. બધાંના મન હળવાં ફૂલ રહેશે.

- ડૉ. ઓમપ્રકાશ

(મૃત્યુ પર શોક સંબંધી એક પ્રશ્ન પર શ્રી ગોયનકાજી દ્વારા અપાયેલા એક ઉત્તરપર આધારિત)

### દોહા ધરમના

પ્રજા શીલ સમાધિ હી, શુદ્ધ ધરમ કા સાર ।  
જો કોઈ ધારણ કરે, હોય દુખો કે પાર ॥  
ક્ષણ ક્ષણ મંગલ હી જગે, ક્ષણ ક્ષણ સુખ હી હોય ।  
ક્ષણ ક્ષણ અપને કર્મ પર, સાવધાન ચંદ્ર હોય ॥  
કાચા વાણી મોન હૈ, હુઆ ચિત્ત ભી મોન ।  
ઉસ સાધક-સા જગત મેં, ભાગ્યવાન હૈ કોન ॥

### ટ્રાંસમેટલ લિમિટેડ

૩૦૧-બી ટાવર, અલ્કાપુરી આર્કેડ, આર.સી. દાટ રોડ,  
વડોદરા-૩૬૦ ૦૦૭. ફોન : ૨૩૪૩૩૦૨/૦૪ ની મંગળકામનાઓ સાથે